



I B Patel English School (Primary)

2020 - 2021

Class - 5

WORKSHEET

Subject – Gujarati

Chapter – 1 (વાંદરાને વાંચતાં ન આવડે)

Q.1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

- (1) આ પાઠમાં દર્શાવેલ પક્ષીને સુઘરી શા માટે કહેવામાં આવે છે ?
- (2) ખટપટ વાંદરો શિયાળામાં કેવી રીતે ઠંડી ભગાડતો હતો ?
- (3) સુઘરીએ વાંદરાને શી સલાહ આપી ?
- (4) ઘર હોય તો ક્યા - ક્યા લાભ થાય ?

Q.2 (a) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

- | | |
|----------|-----------|
| (1) ઝાડ | (5) અચરજ |
| (2) આકાશ | (6) આગ |
| (3) પવન | (7) દોસ્ત |
| (4) પાણી | (8) ડર |

Q.2 (b) નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો.

- | | |
|------------|-----------|
| (1) થોડા | (5) ઠંડી |
| (2) પૃથ્વી | (6) મિત્ર |
| (3) લાંબુ | (7) ઉપર |
| (4) શરૂઆત | (8) ભીનું |

Q.2 (c) નીચેના શબ્દોની સાચી જોડણી લખો.

- | | |
|--------------|-------------|
| (1) ધ્રુઝવું | (5) ઊનાળો |
| (2) પુછડી | (6) ચીંતા |
| (3) ભીન્જવું | (7) ચોમાશું |
| (4) વિજળી | (8) બીચારા |

Q.3 નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.

- (1) સુઘરીનું નામ _____ છે.
- (2) વાંદરાએ _____ માં ફરી ફરીને લાલ મરચાં ભેગાં કર્યાં.
- (3) ઉનાળામાં આકાશમાંથી _____ વરસી રહી હતી.
- (4) સુઘરીએ વાંદરાને _____ બનાવવાની સલાહ આપી.
- (5) વાંદરા _____ નું મિનારા જેવું બનાવીને બેઠા હતા.

Answer Key

Q.1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

(1) આ પાઠમાં દર્શાવેલ પક્ષીને સુઘરી શા માટે કહેવામાં આવે છે ?

જવાબ : સુઘરી સરસ ઘર બનાવે છે એટલે તેને સુઘરી કહેવાય છે.

(2) ખટપટ વાંદરો શિયાળામાં કેવી રીતે ઠંડી ભગાડતો હતો ?

જવાબ : ખટપટ વાંદરો એક ડાળથી બીજી ડાળે ફરીને તથા એક છાપરાથી બીજી છાપરા પર કૂદીને ઠંડી ભગાડતો હતો.

(3) સુઘરીએ વાંદરાને શી સલાહ આપી ?

જવાબ : સુઘરીએ વાંદરાને ઘર બનાવવાની સલાહ આપી.

(4) ઘર હોય તો ક્યા - ક્યા લાભ થાય ?

જવાબ : ઘર હોય તો શિયાળામાં ઠંડી ઓછી લાગે, ઉનાળામાં ગરમી ઓછી લાગે અને ચોમાસામાં વરસાદથી બચી શકાય.

Q.2 (a) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

(1) ઝાડ - વૃક્ષ

(5) અચરજ - નવાઈ

(2) આકાશ - ગગન

(6) આગ - અગ્નિ

(3) પવન - વાયુ

(7) દોસ્ત - મિત્ર

(4) પાણી - નીર

(8) ડર - ભય

Q.2 (b) નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો.

(1) થોડા x વધારે

(5) ઠંડી x ગરમી

(2) પૃથ્વી x આકાશ

(6) મિત્ર x દુશ્મન

(3) લાંબુ x ટૂંકું

(7) ઉપર x નીચે

(4) શરૂઆત x અંત

(8) ભીનું x સુકું

Q.2 (c) નીચેના શબ્દોની સાચી જોડણી લખો.

(1) ધુઝવું - ધુજવું

(5) ઊનાળો - ઉનાળો

(2) પુછડી - પૂછડી

(6) ચીંતા - ચિંતા

(3) ભીન્જવું - ભીંજવું

(7) ચોમાશું - ચોમાસું

(4) વિજળી - વીજળી

(8) બીચારા - બિચારા

Q.3 નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.

(1) સુઘરીનું નામ ખટપટ છે.

(2) વાંદરાએ ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગાં કર્યાં.

(3) ઉનાળામાં આકાશમાંથી આગ વરસી રહી હતી.

(4) સુઘરીએ વાંદરાને ઘર બનાવવાની સલાહ આપી.

(5) વાંદરા પૂંછડીનું મિનારા જેવું બનાવીને બેઠા હતા.